

સુપ્રભાતમુ
સુરેશ પ્રા. મહ.
ફોન : ૨૨૨૬૨૪૧

સલામી સવારની..

વિવાહિત નિવેદનો તો 'સામના'નો વારસો છે મતનો ધૂવીકરણનો જ ખોટો કારસો છે મારસો લોકશાળને હારસો નિષ્ઠા-મૂલ્યથી - બંધારણની મજાક ઉડાડવાનાં આ ફારસો છે. (મુસ્લિમો ને મતદાન હક્ક નહીં)

વજુભાઈની -
કણિકા વાડામાં
થૈંડી..

અમદાવાદ
એપોર્ટ બન્યું છે -
સોના ની ખાણ..



(અહીં પડવા-પાથરાની નહીં રહેવાય) (રોજ સોન્ય મળે છે)

ચિંતન

વદનાચય બદિયાનિ પ્રાણાપાંચા અકેઝે: સહ: દામીચિકારેદિતુ: પુન: કણાંદિશનિ હિ । 'મન આપો' આ પ્રકારના શાંદો-ચાચાના માટેના વિનંતીના અક્ષરો બોલતાની સાથે જ બોલાના-ચાચાની માણ એના મૂલ્યમાં નિકળે છે. અથવા એટલી બીજી શરમ અનુભવે છે કે જો એની ખુલ્લે પણ અને એની જીવની જતો લાગે થેનું. પરંતુ દાન આપનાર વ્યક્તિ જાયાએ આ શાંદો સાંભળે છે ત્વારે થોડો પણ સમય વ્યતીત કર્યા બિના જ એ ચાચકને કહે છે, 'જા - આપું શુ.'

સ્વામીની ચાચા કાયાએ કોઈની પાણી ચાચાના કરતો નથી. સંભેગવસાત કાયાએ અચાનક જરદ ઊભી ચાચા અને નું કાયાનું પડે ત્વારે એનો જીવન આંદોલન જાયાએ આ નું મારાં ચાચાનું નથી. એનો પોતે મરણ-શરણ નથી. એની થાક જો એનું વ્યક્તિ છે એ પણ સાંભળે એનું જીવન આંદોલન જાયાએ આપાની વાત કહે ત્વારે જ ચાચાના જીવનાં જીવ આવે છે.

સુવિધાર

- ઘરમાં વસાવોલા દીની, ફીજ વગેરે એ તમારી આધિક પરિસ્થિતિનું થોડીઓટ છે, તો મનમાં રહેતી મસાના એ તમારી અધ્યાત્માનામાં થથેથી મગનિનું થોડીઓટ છે - આધાર્ય રસનુંદરજુ
- ચાદિય એટલે.. કોઈ પણ માણસની વૃદ્ધિઓનો સમૃદ્ધ, તનાં માનસિક વલણોનો સરવાળો - સ્વામિ વિશેનું
- આપણું જુંનું કરનાર પર્યે જરા પણ જૂદાં કરવાનો વિચાર સુધ્યાં ન આવે ત્વારે સમયનું કે જુદ્ધિમાં શુદ્ધિ આવી છે - માનસશુદ્ધિ
- ચોગ આચારણથી 'ચોગી' બનાયા, ભૂલોની પરંપરાથી 'ભોગી' બનાયા અને સંચમના - ધર્મજીના
- એનિયન વર્ષા કે પાણીને પાણ્યા કરતા વધુ મહિનાનું એ છે એ તમે એ કાયાનું કેટલો 'પાણ પૂર્વો'
- સુધી પ્રત્યે મિત્રતા, હુંઘી પ્રત્યે કરતા, પુણ્યાણી પ્રત્યે મૃદુલા, અને પાપી પ્રત્યે ઉપેક્ષા ચાચાનાની વિચારના થાયા. મનમાં લે સંભળી થોડી તો કોઈ પૈસાદાં નથી અને નું જીવનાની વિચારના નથી.. માનસશુદ્ધિ
- સંજળાની 'ચોલેટીં' બનાયા, જીવાનાની વિચારના નથી.. એનો પોતે મરણ-શરણ નથી. એની થાક જો એનું વ્યક્તિ છે એ પણ સાંભળી નથી. એની થાક જો એનું વ્યક્તિ છે..
- સંજળાની 'ચોલેટીં' છે એ જાયાએ તમે એની થાક જો એનું વ્યક્તિ છે..
- (સંકલન : દીપક વિ. આસરા)

બોધ કથા

આજ તો સત્તા બદલાય એટલે જૂના કોલાંડો અને તપાસોની ફાઇલ ફરી ખૂબે અને ક્રોન્યાની વિચારની ચોકાંનો ગોકાવાય છે. બદલા અને વર્દેનેની ભાવના પક્ષોની રાજકારણમાં પરંપરા છે.

ગ્રીસનો રાજ પેનિલિસ ન્યાચી અને સમાજાલી રાખ હતો. સવારે લટાર મારવા નીકળો. ત્યારે ક્રમાંનો નાનું પડતી - ચાલાંનો નિભાયું. ત્યારે ક્રમાંનો એક વિરોધ પક્ષનો નેતા રાજ પેનિલિસને લેજ તોના વિચારની ભાગના જરૂર છે. સંત ફોર્સેસ

• સંજળાની 'ચોલેટીં' છે એ જાયાએ તમે એની થાક જો એનું વ્યક્તિ છે..

દાના ચાચાની વિચારની ત્યારે એની થાક જો એનું વ્યક્તિ છે..

Email - sureshchandrabhatt18@gmail.com

ભૂતે આજે ખરેખર કોઈ સારા માણસનું મોકું સવાર સવારમાં જોયું હોવું જોઈએ, એક પછી એક તેની મન મરજી મુજબ થતું હતું, તેણે પોતાની રંગ ઉડી ગયેલ પાદાડી ઉતારી અને કમરે બાંધી, પટલાણી કંઈ કહે તે પહેલાં તે ખેતરમાં ઘુસી ગયો

(ગતંકીયાઓણ)

અન્યાન્ય સુધી જે અધું રેખું વિચાર્યું પણ ન હતું, તેને સમજ પડતો નહોતો કે શું કહેલું તાં પટલાણીની પુણી બેઠી, 'ભાઈ ક્યે ગામ રહેલું એના બાંધું કર્યાયો?' પટેલ, ડેરૂન માણસનુંપુણી, ક્રમ પુણી જાયારે સવારની લોકોને પણ નાનું, ભૂલું હું 'શું ભૂલું હું' તારી સાથે વાત કરવા આથ્વોનું 'પટલાણી હંગી પરી.' જાયારે ક્રાયેક તેનું મન હીંદું અને વાત કરવી પડે ત્યારે એરીશાઈ જીવાની અથવા પટેલને આવા જ આજાયાણાના જાવાનો આપીયા તે બોલી, 'સ્વાઈ નારાજ હું' ક્રમ થવાનું. ના કહેલું હોય તો એની પોતાની કાંઠોની હંગીની બાસારની પરી.

ભૂલે વાંદોલો લીટો, 'શું કંન માણાં બસ, મારે શું ગરજ હું કે આવતા જતાની હારે મજાક કરણ.'

ચીટ્ટાનું, મેં કર્યાએ વાત કર્યાએ, એની થાક જો એનું વ્યક્તિ છે..

ચીટ્ટાનું, મેં કર્યાએ વાત કર્યાએ, એની થાક જો એનું વ્યક્તિ છે..

ચીટ્ટાનું, મેં કર્યાએ વાત કર્યાએ, એની થાક જો એનું વ્યક્તિ છે..

નવાં કલેવર

- નવાં કલેવર

અન્યાન્ય વિચારની અથવા પણ એની થાક જો એનું વ્યક્તિ છે..

અન્યાન્ય વિચારની અથવા પણ એની થાક જો એનું વ્યક્તિ છે..

અન્યાન્ય વિચારની અથવા પણ એની થાક જો એનું વ્યક્તિ છે..

અન્યાન્ય વિચારની અથવા પણ એની થાક જો એનું વ્યક્તિ છે..

અન્યાન્ય વિચારની અથવા પણ એની થાક જો એનું વ્યક્તિ છે..

અન્યાન્ય વિચારની અથવા પણ એની થાક જો એનું વ્યક્તિ છે..

અન્યાન્ય વિચારની અથવા પણ એની થાક જો એનું વ્યક્તિ છે..

અન્યાન્ય વિચારની અથવા પણ એની થાક જો એનું વ્યક્તિ છે..

અન્યાન્ય વિચારની અથવા પણ એની થાક જો એનું વ્યક્તિ છે..

અન્યાન્ય વિચારની અથવા પણ એની થાક જો એનું વ્યક્તિ છે..

અન્યાન્ય વિચારની અથવા પણ એની થાક જો એનું વ્યક્તિ છે..

અન્યાન્ય વિચારની અથવા પણ એની થાક જો એનું વ્યક્તિ છે..

અન્યાન્ય વિચારની અથવા પણ એની થાક જો એનું વ્યક્તિ છે..